



RAN-2401000105025061

T.Y.B.A. (Non NEP) (Sem. - V) Examination November - 2025
Economics (Paper - CC-XVI:B) Banking and Financial Markets

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.
- (2) પ્રશ્ન નં.૧ ફરજિયાત છે.
Question No.1 is compulsory.
- (3) જમણી બાજુના અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે.
Figures to the right indicate full marks of the question.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર.1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.

(10)

1. વેપારી બેંકના કોઈપણ બે બિન-પ્રણાલિકાગત કાર્યો જણાવો.
2. 1969 માં બેન્કિંગ રાષ્ટ્રીયકરણ થયું ત્યારે ભારતના વડાપ્રધાન કોણ હતા?
3. ગુણાત્મક શાખ નિયંત્રણના કોઈપણ ચાર સાધનો જણાવો.
4. ઓવરડ્રાફ્ટ અને કેશક્રેડિટનો અર્થ આપો.
5. ઈનોવેટિવ બેન્કિંગ એટલે શું?

પ્ર.2. બેંક રાષ્ટ્રીયકરણ પછીનાં સમયગાળા દરમિયાન ભારતના આર્થિક વિકાસમાં વેપારી બેંકોના ફાળાની ચર્ચા કરો.

(13)

અથવા

પ્ર.2. કૃષિ ધિરાણ ક્ષેત્રે સહકારી સંસ્થાઓની ભૂમિકા તપાસી તેમની કામગીરી નું મૂલ્યાંકન કરો.

(13)

પ્ર.3. પરિમાણાત્મક શાખ-નિયંત્રણના સાધન તરીકે ખુલ્લા બજારનીતિ અને રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરવાની નીતિ સમજાવો અને આ સાધનોની મર્યાદાઓ જણાવો.

(13)

અથવા

પ્ર.3. ભારતના બેન્કિંગ ક્ષેત્રે તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓની ચર્ચા કરો.

(13)

પ્ર.4. ટૂંક નોંધ લખો (ગમે તે બે)

(14)

1. શાખ સર્જન શક્તિની મર્યાદાઓ
2. બેંક રાષ્ટ્રીયકરણ ના ઉદ્દેશો
3. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ના કાર્યો
4. એકમ બેન્કિંગ અને શાખા બેન્કિંગ

ENGLISH VERSION

- Q.1. Answer briefly. [10]**
1. State any two non-traditional function of the commercial banks.
 2. Who was the prime minister of India when Banking Nationalization was done in 1969 ?
 3. State any four tools of qualitative credit control.
 4. Give the meaning of overdraft and cash credit.
 5. What is innovative Banking?
- Q.2. Discuss the role of commercial bank after nationalization in the economic development of India. [13]**
- OR**
- Q.2. Evaluation of the performance and the role of co-operative institutions in Agriculture credit. [13]**
- Q.3. Explain the open market policy and variations in cash reserve ratio policy as quantitative tools of credit control. State the limitations of the tools. [13]**
- OR**
- Q.3. Explain the recent reforms in banking sector of India. [13]**
- Q.4. Short notes: (Any Two) [14]**
1. Limitations of the credit creation capacity.
 2. Objectives of bank nationalization.
 3. Function of Reserve Bank of India.
 4. Unit banking and Branch banking.
-